

પત્રક-૧

‘પીજીવીસીએલ વિભાગીય કચેરી લોક દરબાર - ૨૦૧૮’

વિભાગીય કચેરી : સાવરકુંડલા, વર્તુળ કચેરી : અમરેલી, તારીખ : 07/03/2018, સમય : 10:30

નિરાકરણ કરનાર અધિકારીશ્રીનું નામ અને મોબાઇલ નંબર : શ્રી કે કે સૈની, કાર્યપાલક હજનેર , વિભાગીય કચેરી, સાવરકુંડલા, મોબાઇલ નં.૯૯૨૫૨૦૯૩૮૧
રજુ થયેલ પ્રશ્નોની સંખ્યા : 2, નીતિ વિષયક પ્રશ્નોની સંખ્યા : 0, નિકાલ પ્રશ્નોની સંખ્યા : 2, પ્રગતિ ફેઠળ પ્રશ્નોની સંખ્યા : 0

ક્રમ	રજુઆતકર્તાનું નામ	પ્રશ્નની વિગત	લોક દરબારમાં આપેલ જવાબ	અદાતન જવાબ	નિકાલની સ્થિતિ
1	છોટાલાલ ફરીશંકર બોરીસાગર સાવરકુંડલા મો. ૯૪૨૯૨૫૬૪૫૩	સાવરકુંડલા ગામના દેવળાગેઇટ વિસ્તાર માં આવેલ પીપળાવાળી શેરી અને તેની આસપાસ ના વિસ્તાર માં સવારે ૬ (છ) વાગ્યે જ્યારે પાણી નો વારોફોઇ ત્યારે લાઇટ જાય છે જેથી પાણી આવતુંબંધ થઇ જાય અને સમય પુરો થાય એટલે પાણી લાઇટ શરુ થઇ જાય છે. તો જરૂરી સમારકામ કરાવી આપવા વિનંતી છે.	અરજદાર ની રજુઆત અન્વયે નાયબ હજનેર શ્રી સાવરકુંડલા શહેર દ્વારા દેવળા ગેઇટ વિસ્તાર માં આવેલ પીપળાવાળી શેરી ના આસપાસ ના વિસ્તાર નું સ્થળ પર નું જરૂરી સર્વે કરી જરૂરિયાત મુજબ નું સમારકામ દિવસ -૭ (સાત) માં કરી આપવામાં આવશે.	અરજદાર ની રજુઆત અન્વયે નાયબ હજનેર શ્રી સાવરકુંડલા શહેર દ્વારા દેવળા ગેઇટ વિસ્તાર માં આવેલ પીપળાવાળી શેરી ના આસપાસ ના વિસ્તાર નું સ્થળ પર નું જરૂરી સર્વે કરી એક સકીટ ના લોડ નું વિભાજન કરી તેમાં ૨ નવા એલ ટી લાઇન ના પોલ તથા ૯૦ મીટર નવો એબીસી કેબલ નાખી તેમાં ૨ -થી ફેઇજ તથા ૧૫-સીંગલ ફેઇજ ના વીજજોડાણો ફેરવી લોડ નું વિભાજન કરી ડબલ સકીટ કરી આપેલ છે. આમ, જરૂરિયાત મુજબ નું સમારકામ તારીખ ૮.૩.૨૦૧૮ ના રોજ કરી પ્રશ્ન નું નિરાકરણ કરવામાં આવેલ છે.	નિકાલ મેઇન્ટેનન્સ
2	રેખાબેન જીલુભાઇ જાજડા ગામ મઢડા મો. ૮૧૨૩૧૧૮૫૯	તારીખ ૨૦.૦૧.૨૦૧૭ નાં રોજ મઢડા ગામે મારા પત્ની જીલુભાઇ ભાભલુભાઇ જાજડા નું પીજીવીસીએલ નાં વીજ પોલ ને અડકતા વીજશોક લાગવાને કારણે મરણ થવા પામેલ હતું તેની પ્રાથમિક આસ્થિક સહાય આજ દિવસ સુધી મળેલ નથી મારા બાળકો ખુબજ નાના ફોવાના કારણે મારા પરિવાર ની જવાબદારી મારા પર આવેલ ફોઇ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવતી પ્રાથમિક આસ્થિક સહાય મને આજ દિવસ સુધી મળેલ નથી તો લોક દરબાર ની સુનાવણી માં યોગ્ય નિર્ણય કરવા મારી નમ્ર વિનંતી છે.	તારીખ ૨૦.૦૧.૨૦૧૭ ના રોજ થયેલ વીજ અકસ્માત ની જાણ વિજપડીપોલીસ સ્ટેસન દ્વારા વિજપડી પેટા વિભાગ કચેરી ને કરવામાંઆવેલી હતી. પોલીસ દ્વારા સ્થળ પર કરેલ રોજકામ માઅરજદાર ના પ્રતિનિધિ શ્રી કનુભાઇ ભાભલુભાઇ જાજડા એ સ્પષ્ટ જણાવેલ છે કે સદર અકસ્માત પીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર ના પોલ ની ઘાયને અડવાથી થયેલ નથી .વધુમાં પોલીસ સ્ટેસન ની જાણ બાદ વિજપડી પેટા વિભાગ પી.જી.વી.સી.એલ. ના અધિકારી તથા કર્મચારી ના સ્થળ પરના રોજકામ મુજબ ટ્રાન્સફોર્મર ના પોલ નીઘાય તથા ઘાય ઇન્સુલેટર કંપની ના નિયમ મુજબ લાગેલ હતા .તેથી ઘાય માં કરંટ નીચે ઉતરવાનું શક્ય નથી.આમ આ અકસ્માત ઘાય ને અડવાથી થયેલ નથી તેવું સ્પષ્ટ થાય છે. જેથી નિયમાનુસાર વળતર આપી શકાય નહીં.	તારીખ ૨૦.૦૧.૨૦૧૭ ના રોજ થયેલ વીજ અકસ્માત ની જાણ વિજપડીપોલીસ સ્ટેસન દ્વારા વિજપડી પેટા વિભાગ કચેરી ને કરવામાંઆવેલી હતી. પોલીસ દ્વારા સ્થળ પર કરેલ રોજકામ માઅરજદાર ના પ્રતિનિધિ શ્રી કનુભાઇ ભાભલુભાઇ જાજડા એ સ્પષ્ટ જણાવેલ છે કે સદર અકસ્માત પીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર ના પોલ ની ઘાયને અડવાથી થયેલ નથી .વધુમાં પોલીસ સ્ટેસન ની જાણ બાદ વિજપડી પેટા વિભાગ પી.જી.વી.સી.એલ. ના અધિકારી તથા કર્મચારી ના સ્થળ પરના રોજકામ મુજબ ટ્રાન્સફોર્મર ના પોલ નીઘાય તથા ઘાય ઇન્સુલેટર કંપની ના નિયમ મુજબ લાગેલ હતા .તેથી ઘાય માં કરંટ નીચે ઉતરવાનું શક્ય નથી.આમ આ અકસ્માત ઘાય ને અડવાથી થયેલ નથી તેવું સ્પષ્ટ થાય છે. જેથી પીજીવીસીએલ ના પ્રવર્તમાન નિયમાનુસાર વળતર આપી શકાય નહીં.	નિકાલ અકસ્માત વળતર
			એકપણ રજુઆત આવેલ નથી		
			એકપણ રજુઆત આવેલ નથી		
			એકપણ રજુઆત આવેલ નથી		
			એકપણ રજુઆત આવેલ નથી		
			એકપણ રજુઆત આવેલ નથી		